

NALIN LEASE FINANCE LTD.

CIN: L65910GJ1990PLC014516

Date: 07/11/2025

To,
BSE Ltd.
Phiroze Jeejeebhoy Towers
25th Floor, Dalal Street
Mumbai- 400 001
Company Code 531212

Subject: <u>Publication of Unaudited Financial Results for the quarter and half-year ended on 30th September, 2025</u>

Dear Sir(s),

Pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we inform you that the Unaudited Financial Results for the quarter and half-year ended on 30th September, 2025 of the Company has been published in Western Times (English & Gujarati) newspapers on Friday, 07th November, 2025.

Copies of the said publication are enclosed for your reference.

Kindly take the same on record and acknowledge the receipt of the same.

Thanking you,

Yours faithfully,

For Nalin Lease Finance Limited,

Nikul Patel

Chief Financial Officer

Enclosure: As above

ogy upgrades, process

automation, and talent

acquisition to strength-

en its operations and

retail presence. Space-

wood operates one of

India's largest integrat-

ed furniture manufactur-

ing facilities, spanning

over 1 million sq. ft. and

equipped with state-of-

the-art panel and sheet

metal processing tech-

nologies. Its diverse

product portfolio covers

modular kitchens, ward-

robes, home furniture,

pre-hung doors, and of-

fice furniture under the

has 35+ exclusive stores

across 20+ cities and a

dealer network of 500+

partners in 150 towns

and cities. It plans to ex-

pand to 100 stores na-

tionwide in the next few

years, further strengthen-

ing its omnichannel pres-

ence through platforms

such as Amazon and

Currently, Spacewood

SOS brand.

Pepperfry.

Berger Paints Posts Rs 2,827.5 Crore Revenue in Q2, Profit Declines 23.5%

India Limited, one of India's leading paint, coatings, and waterproofing companies, announced its financial results for the quarter ended September 30, 2025, reflecting a resilient performance despite a muted

demand environment. For the quarter, Berger Paints reported consolidated revenue from operations of Rs. 2,827.5 crores, marking a 1.9% increase compared to Rs. 2,774.6 crores in the same period last year. However, EBIT-DA (excluding other income) declined by 18.9% to Rs. 352.3 crores from Rs. 434.2 crores, while net profit dropped by 23.5% to Rs. 206.4 crores from Rs. 269.9 crores year-on-year.

On a standalone basis. revenue grew marginally by 1.1% to Rs. 2,458.5 crores. EBITDA reduced by

Mumbai, Berger Paints 18.8% to Rs. 311.2 crores and net profit was down by 23% at Rs. 176.3 crores.

The half-year results

also reflected a similar trend of moderate revenue growth and profitability pressure. Consolidated revenue for the first half of FY26 stood at Rs. 6,028.3 crores, up 2.8% from Rs. 5,865.6 crores in the previous year. EBITDA and net profit declined by 7.9% and 16.4% respectively, contributing Rs. 880.7 crores_and Rs. 521.4 crores. The standalone figures echoed this pattern with revenue increasing 1.6% to Rs. 5,321.1 crores and profitability dipping.

Abhijit Roy, Managing Director & CEO of Berger Paints India Limited, attributed the muted growth to an extended monsoon season which impacted demand across key markets. "Despite these challenges, we delivered high single-digit volume growths and maintained a low positive revenue growth. Our market share for April to September 2025 has improved over FY25 levels among major listed paint companies," he stated.

Profitability was impact-

ed by scale effects, a less favorable product mixowing to lower sales of exterior products—and high-er investments in brandbuilding activities during the quarter. Nevertheless. key segments like waterproofing, construction chemicals, and wood coatings sustained robust growth. Other segments, including automotive and powder coatings, recorded mid-single-digit growth, while protective and general industrial coatings real industrial coatings re-

mained flat.

Mafatlal Industries Delivers Record Rs. 2,269.9 Crore Half-Yearly Revenue

Mumbai, Mafatlal Industries Limited, a century-old leading name in Indian textiles, announced today its unaudited financial results for the quarter and halfyear ended September 30, 2025 (Q2 & H1FY26). The company reported its highestever half-yearly revenue, driven by robust growth in the institutional, uniforms, consumer durables, and textile seg-

ments. For H1FY26, revenue from operations grew significantly on a YoY basis from Rs. 1,447.3 crore to Rs. 2,269.9 crore, led by the execution of large institutional orders and increased traction in the textile and related product segments. The company's operating EBITDA also saw a healthy year-on-year growth of 53.5%, reflecting improved operational efficiency and improved underlying business performance

During Q2FY26, the company clocked a healthy improvement in operational profitability, andoperating EBITDA growth outpaced total EBITDA growth, asoperations fueled profitability rather than non-recurring income sources.

The digital infrastructure segment gained momentum during the quarter, driven by institutional orders for setting up Personalized Adaptive Learning (PAL) Labs equipped with integrated software solutions and after-sales service. As of September 30, 2025, the company's gross debt was Rs. 58.0 crore, of which long-term debt was Rs. 31.5 crore. The company continues to main-

The Board of Directors also approved an interim dividend of Rs. 1.25 per equity share for FY26.

tain a healthy balance

CHANGE OF NAME

I have changed my old name from HIMANI ASHOKBHAI PATEL to new name HIMANI DHRUVKUMAR PATEL **Add.** 14/B, Kalyan Bunglows Kheralu Road, Visnagar,

Paldi Ahmedabad

PUBLIC NOTICE **CHANGE OF NAME** I the undersigned Advocate, Viral Gaudhaviya, under the instruction of My Client herewith issue this Public Notice to the concerned person that, Subject Property as 'Tenament No. D/11, along with construction adm. 71.90 Sq. Mtrs. on Ground Floor And First Floor (125 Sq. Mtrs as BIPINBHAI SHAH Par Tax Bill), of "Sitabaug Society", of Janakpuri Owners Association constructed on Block/Survey No.572/1/1 and

Mouje-Isanpur, Taluka- Maninagar District & Sub District Ahmedabad-5(Narol). This property is presently owned by KIRITKUMAR POPATLAL NAI. The Following Document not found in this Property File.

(1) Share Certificate bearing Share No. 159 on dated 17.06.2001, Allotment Letter, and Possession Letter in the name of Rameshchandra Chhotalal Suthar, is misplaced and not traceable and therefore society issued Duplicate Share Certificate, Allotment Letter, and Posses

572/2 (T.P. Scheme No. 54, Final Plot No.122 and 123.

sion Letter. My Client- (1) RADHAKRISHNA SUBALCHANDRA DAS (2) BAISAKHI RADHAKRISHNA DAS have applied for Home Loan at UCO Bank, and they wishes to create

charge on this property. This Document has been lost and Not found and FIR was registered before Narol Police Station on 20/04/2021 for

If any person/body have/has any objection regarding this Transaction thereon, are free to write us on the following address with supporting documents "within 7 days" of publication of this Public Notice. Otherwise, my clients will be deemed to have obtained Title Clear Report issued by me without any objection.

. Viral Gaudhaviya(Advocate) Add: 104, Pratibha-1, Opp. Gandhigram Railway Station,

b/h, Sakar-I, Ashram road

PLACE: AHMEDABAD DATE: 06/11/2025 Ahmedabad-09 Mo. 9998150971

CHANGE OF NAME I have changed my old name from KHALID ABDULREHMAN SHAIKH to new name MOHMAD KHALID ABDULREHMAN SHAIKH Add. 3-2-B, Aashiyana Apat

have changed my old name from AKSHAT BIPIN SHAH to new name AKSHAT Add. B/1/16. AMRAPALI TOWER, PALDI. AHMEDABAD

RAJKOT DIVISION OHE MODIFICATION WORK Tender Notice No. DRM/RJT/E-Tender/EL/TRD/25-26/25 Dt 04.11.2025 **Tender No:** DRM-RJT-EL-TRD-25-26-25 Name of Work

OHE modification work in connection with providing PSC Slab in lieu of steel girder bridge a Bridge No.22 between LPR-KXZ section and provision of escalato at platform 1/2/3 and 4/5 Rajko station and PF 1&2/3 of Jamnaga station at 12-meter wise FOB in the jurisdiction of Rajkot division Approx. Cost: ₹ 34,06,939.82/-Only Earnest Money: ₹ 68,100/ Date & time for Online apply: Or 02.12.2025 up to 15.00 Hours Address of the Office: Divisiona Railway Manager (Electrical/ Traction), Western Railway, Kothi Compound, Rajkot - 360001 Web site particulars: "www.ireps.gov.in" Like us on: f facebook.com/WesternRlv

NALIN LEASE FINANCE LIMITED

CIN: L65910GJ1990PLC014516 Regd.Off: Ground Floor, Gandhi Nursing Home Bldg., Dr.Nalinkant Gandhi Road, Himatnagar- 383 001. Gujarat India Phone: 02772-241264, 242264, email: info@nalinfin.co.in, www.nalinfin.co.in

EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30.09.2025 (Rs.in Lacs)

			(NS.III Lacs		
SI. No.	PARTICULARS		For the year ended		
		30 Sep 2025	30 June 2025	30 Sep2024	31 March 2025
		Unaudited	Unaudited	Unaudited	Audited
1.	Total Income From Operations	177.67	204.76	173.65	642.28
2.	Net Profit/(loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	107.41	135.37	116.13	442.69
3.	Net Profit/(loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	107.41	135.37	116.13	442.69
4.	Net Profit/(loss) for the period after Tax(after Exceptional and/or Extra- ordinary items)	76.13	92.40	69.39	352.34
5.	Total Comprehensive Income for the period (Comprising Profit /(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax)	76.13	92.40	69.39	352.34
6.	Paid up Equity Share Capital	655.82	655.82	655.82	655.82
8.	Earnings Per share (of Rs 10/- each) (for continuing and discontinuing operations)-				
1.	Basic:	1.16	1.41	1.06	5.37
2.	Diluted:	1.16	1.41	1.06	5.37

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Ex changes under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015 The full format of the Quarterly Financial Results is available on the BSE website (www.bseindia.com) 8 Company's website (www.nalinfin.co.in)

Place: Himmatnagar Date : 06-11-2025



For, NALIN LEASE FINANCE LTD Harsh D Gandhi Managing Director

Spacewood Raises Rs. 300 Crore from A91 Partners to Accelerate Growth

Mumbai, Spacewood Furnishers Pvt. Ltd. ("Spacewood"), India's leading modular furniture manufacturer and brand, has raised ?300 crore in funding from A91 Partners, a marquee private equity firm focused on building consumer and growth-stage businesses ín India.

The investment gives A91 Partners a significant minority stake in Spacewood and will fuel the company's next phase of expansion, brand-building, and operational strengthening.

Speaking on the development, Mr. Kirit Joshi, Co-founder and Director, Spacewood, said: "We are excited to have A91 Partners on board. Beyond capital, they bring deep experience in scaling consum-er brands, which will be invaluable as we embark on our next growth phase.

Adding his perspective on the investment, Mr. Abhay Pandey, Partner at A91 Partners, said, "We are looking forward to the opportunity to partner with Kirit, Vivek, and Nitin in further building a

CHANGE OF NAME

have changed my old name from DHAKKANJIWALA FARUQUE KARIMBHAI to new name DHAKKANJIWALA **FARUKBHAI**

Add. 3667 Piplawali Gali Mota Bamba Kazis Dhaba Astodia Ahmedabad-01 3261

CHANGE OF NAME

have changed my old name from VADOR BHIMJI JETHALAL to new name BHIMJI VADOR Add. 1003-10th Floor, Shikar Tower, Vikasgruh Marg, Paldi, Ahmedabad-380007

dominant company in the large and growing market of home and office improvement

Founded in 1996 by Mr. Kirit Joshi and Mr. Deshpande, Vivek Spacewood has established itself as one of the most trusted names in India's organised furniture sector. In 2011, Mr. Nitin Sudame joined as the founder of Spacewood Office Solutions (SOS), leading the com-

pany's expansion into

the office furniture seg-

ment.

With a focus on design innovation, durability, and craftsmanship, Spacewood has built a strong reputation as a full-home modular solutions provider. For FY26 (estimated), the company expects to achieve group revenues of approximately ?700 crore. With A91 Partners' backing, Spacewood aims to accelerate its revenue trajectory, targeting 25-30% annual growth over the next five years with a focus on profitability. The fund-ing will support technol-

CHANGE OF NAME

I have changed my old name from MARFATIYA MOHMODMOIZ MOHMODNAZIR to new name MOHAMMADMOIZ MOHAMMADNAJIR MARFATIYA

Add. Vhoravad Prantij Taluka: Prantii Dist: Sabarkantha-383205

CHANGE OF NAME have changed my old name

from VADOR RASILABEN BHIMJI to new name RASILA BHIMJI VADOR Add. 1003-10th Floor. Shikar Tower, Vikasgruh Marg, Paldi, Ahmedabad-380007 3258A

WESTERN RAILWAY - RAJKOT DIVISION

E-AUCTION FOR THE CONTRACT OF 'LEASING OF SLR/VP' -Auction for the contract of 'Leasing of SLR/VP' has been invited. The atalogue has already been published online on IREPS website. The

3258

Catalogue No	Type of Contract	LOT NO.	Date & Time	Contract Period				
E-SLR- RJT-11-25, Date: 30/10/2025	Leasing of SLR/VP	1) 16734-SLR-R1, 2) 19568-SLR-R1, 3) 22960-SLR-R1, 4) 19568-SLR-F1, 5) 20820-SLR-F1	Lots will start at	03 Years				
he details of Lot mentioned in above catalogues are available under the								

nead of upcoming e-auction, Zone: Western Railway, Department: Commercial, Rajkot Division on www.ireps.gov.in (E-auction Leasing)

Like us on: **f** facebook.com/WesternRly • Follow us on: **X** twitter.com/WesternRly

Business Brief

On Its 50th Anniversary, Sintex sets a 'Guinness World Record' to champion responsible water use across India

Ahmedabad, November 5, 2025: On its 50th anniversary, Sintex, India's most trusted name in water management solutions, has achieved a historic milestone earning a Guinness World Record for mobilizing over 31,000 people in 24 hours to pledge responsible water usage. The nationwide initiative aimed to raise awareness about one of India's most critical challenges ensuring access to clean, safe water and preventing waterborne diseases. Communities, partners, and employees from across the country came together on a digital platform to take the pledge, reinforcing a collective commitment to safeguard water and health.

Yashovardhan Agarwal, Director Sintex & MD Welspun BAPL Ltd "This is an iconic moment for Sintex, with 50 years of legacy and leadership in water storage tanks. Water contamination and improper storage continue to pose serious public health risks in India, contributing significantly to the spread of waterborne diseases. Through this initiative, we are inspiring individuals to make a simple yet powerful commitment - to store both drinking and non-drinking water hygienically by regularly cleaning water storage units thereby preventing contamination and safeguarding the health of their families. Every pledge collected and every individual reached is a step towards a more responsible and clean water-conscious India. This record-setting achievement marks just the beginning of a larger movement!"

Amod Municipality-Amod **Public Tender Tender**

The Chief Officer of Amod Municipality invites tenders for the following works under UDP-88 year 2025-26 and SJMMSVY-Aagvi odkh Yojana, Swarnim Javanti Mukhyamantri Sheheri Sadak Yojana and MLA Grant

Sr.	Work description	Est. cost.
No.		
1	Work to build a shed near a large lake in amod	35,53,3000/-
	Municipality area.	
2	Construction of a compound wall near a large lake in	24,91,269/-
	Amod Municipality area.	
3	Construction of storm water drain in Amod	49,67,400/-
ı	Municipality area.	
4	Construction of Flooring work chlamydia high school	2,00,000/-
l	new hall in Amod Municipality area.	
5	Amod Municipality Small Lake (Marvas) Development	443,39 lakh
	Work (Third Attempt)	
6	Road resurfacing work in Amod Municipality area.	42,42 lakh
I	(Second attempt)	

online tender are invited the above work, Documents and further details of he present work can be downloaded from the website www.nprocure. ne is 21/11/2025 till 06:00 and www.statetenders.gujarat.gov.in. The last date for downloading the tender online, 06:00 pm and the last date for accepting documents from registered post/AD post at this office is 28/11/2025 till 6.10 pm, after which the documents received will not be accepted. The right to approve or reject the tender without giving any reason shall remain unchallenged with Amod Muncicipality.

Pankaj Nayak Chief Officer Amod Municipality

Geetaben G. Patel **Executive Chaiman** Amod Municipality

Jalpaben A. Patel President Amod Municipality

INF/BCH/539/2025

CIN: 1 24219G.11985PI C025132

Regd. Office: 3 -11, G.I.D.C., Vapi, Valsad-396195, Gujarat Telephone: +91 260 2432716 | Email: upl.investors@upl-ltd.com | Website: www.upl-ltd.com

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30[™] SEPTEMBER 2025



	(₹.							
_			Quarter ended			Half year ended		
Sr. No.	Particulars	Sep-25	Jun-25	Sep-24	Sep-25	Sep-24	Mar-25	
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)	
1	Total Income from Operations	12,019	9,216	11,090	21,235	20,157	46,637	
2	Profit / (Loss) before exceptional items and tax	642	(181)	(439)	461	(845)	1,237	
3	Profit / (Loss) before tax	784	(190)	(447)	594	(902)	829	
4	Profit / (Loss) for the period	612	(176)	(585)	436	(1,112)	820	
5	Other Comprehensive Income for the period	1,016	434	600	1,450	162	42	
6	Total Comprehensive Income / (loss) for the period	1,628	258	15	1,886	(950)	862	
7	Total Comprehensive Income / (loss) for the period attributable to owners of the parent	1,306	195	56	1,501	(677)	960	
8	Paid up Equity Share Capital	169	159	150	169	150	159	
	(Face Value of the Share - ₹ 2/- each)							
9	Other Equity	-	-	-	-	-	29,054	
10	Earnings per equity share (not annualised)							
	Basic₹	6.75	(1.94)	(5.68)	4.85	(11.47)	9.85	
	Diluted ₹	6.74	(1.94)	(5.68)	4.84	(11.47)	9.62	

Notes:

- The above is an extract of the detailed format of unaudited consolidated financial results for the quarter and half year ended 30° September 2025 filed with the Stock Exchanges under Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended ("SEBI LODR Regulations"). The full format of the unaudited financial results (consolidated and standalone) for the quarter and half year ended 30th September, 2025 are available on the Company's website viz. www.upl-ltd.com and on the website of BSE (www.bseindia.com) and NSE (www.nseindia.com).
- Key standalone financial information is as under:

							(₹. in Crores)
_			Quarter ended	d	Half yea	Year ended	
Sr. No.	Particulars	Sep-25	Jun-25	Sep-24	Sep-25	Sep-24	Mar-25
140.		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total Income from Continuing Operations	1,512	1,660	1,090	3,172	1,892	5,330
2	Profit / (Loss) before tax from Continuing Operations	355	132	48	487	32	2,045
3	Profit / (Loss) for the period from Continuing Operations	272	122	45	394	29	2,643
4	Profit / (Loss) before tax from Discontinuing Operations	-	-	152	-	250	339
5	Profit / (Loss) for the period from Discontinuing Operations	-	-	102	-	179	296

3. The above results have been reviewed and recommended to the Board of Directors by the Audit Committee at its meeting held on 5th November, 2025 and subsequently approved by the Board of Directors at its meeting held on 6th November, 2025. These results have been subjected to limited review by the statutory auditor.

For and on behalf of UPL Limited

Place: Mumbai Date: 06th November, 2025



Raj Tiwari

DIN - 09772257



હિંમતનગર ઉમિયા વિજય ટીપી રોડ ઉપર રામેશ્વર

સોસાચટીમાં ગટર ઉભરાતા રહીશો પરેશાન

હિંમતનગરઉમિયા વિજય ટીપી રોડ ઉપરઆવેલી રામેશ્વર સોસાયટીમાં

ગટરઉભરાતાસોસાયટીનારહીશોમ્શકેલીનોસામનોકરીરહ્યાછેસતત

છેલ્લાગણાદિવસોથીઉભરાતીગટરનુંગંદુદુર્ગંધમારતુંપાણીઆજુબાજુ

ના રહીશો મકાનોમાં પણદુર્ગંધ ફેલવી રહ્યું છે .જિલ્લા કોંગ્રેસ મહામંત્રી

પ્રિયવદન પટેલે જણાવ્યું હતું કે હિંમતનગર નગરપાલિકા પ્રમુખના જ વોર્ડમાં આ પરિસ્થિતિ છે તો સમગ્ર શહેરના તો શું હાલ હશે ?

જાહેર નોટીસ

જત ગુજરાત રાજ્ય ના રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ અમદાવાદ- પ(નારોલ) ના તાલુકા મણિનગરના મોજે ગામ ઇસનપુરની

સીમના સર્વે નંબર ૫૭૨/૧/૧ તથા ૫૭૨/૨, ટી.પી.સ્ક્રીમ નં.૫૪, વાળી

બિનખેતીની જમીન ઉપર બાંધવામાં આવેલ "ધી જનકપુરી ઓનર્સ

એસોસીએશન્.'' દ્રારા બાંધવામાં આવેલ ''સીતાબાગ ટેનામેન્ટ'' તરીકે

ઓળખાતી સ્ક્રીમમાં આવેલ ટેનામેન્ટ/મકાન નંબર : ડી/૧૧ વાળી મિલકત

કે જેનું ક્ષેત્રફળ પ્લોટ એરીયા ૫૮.૫૨ સમ.ચો.મી. (૭૦.૦૦

સમ.ચો.વાર.) તથા બાંધકામ : ૭૧.૯૦ સમ.ચો.મી. (૮૬.૦૦

સમ.ચો.વાર.) (ગ્રાઉન્ડ તથા ફર્સ્ટ ફલોરના બાંધકામવાળી મીલકત) જેનો

તે મકાનવાળી મિલકત કિરીટકુમાર પોપટલાલ નાઈ ના માલિકી તથા કબજા

સબબ ઉપરોક્ત મિલક્ત અંગેનુંશેર સર્ટીફીકેટ નં.૧૫૯ છે જે

તા.૧૭.૦૬.૨૦૦૧ અને એલોટમેન્ટ લેટર તથા પશેસન લેટર પણ આપવામાં આવેલ હતું જે શરતચુક થી ખોવાઈ ગયેલ છે અને સોસાયટી

દ્વારા ડુપ્લિકેટ શેર સટીફીકેટ એલાટમેન્ટ લેટર તથા પશેસન લેટર

આપવામાં આવેલ છે. આ મિલકત બાબતે અને ટાઇટલ બાબતે કોઇનો

કોઇપણ પ્રકારનો હક્ક, હિસ્સો, હિત, સંબંધ, દાવો, અલાખો, ગીરો, બોજો,

ટાંચ, દરખાસ્ત, લીયન ચાર્જ કે જામીનગીરીનો બોજો હોયતો દિન ૭ (સાત)

માં પ્રમાણિત અને લેખિત પુરાવા સહિત અમોને નીચેના સરનામે જાણ

કરવી, જો તેમ કરવામાં કસુર થશે તો મજકુર ઉપરોક્ત મિલકત ઉપર કોઇ નો કોઇપણ પ્રકારનો હક્ક, હિસ્સો હોયતો જતો યાને કે વેવ કરેલ છે. એમ

સમજી મુદ્દત વીતે થી ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફ્રીકેટ ઇસ્યુ કરી આપવામાં

અમારા અસીલ રાધાક્રિષ્ણ સુબલ્યચંદ્ર દાસ અને બૈશાખી રાધાક્રિષ્ણ દાસ

ને યૂકો બેંક પાસેથી લોન/ક્રેડિંટ સુવિધા માટે ઉપર મુજબ ની પ્રોપર્ટી પર ચાર્જ એટલે કે મોર્ટગેજ કરવા ઈચ્છે છે જે માટે આ નોટીસ આપવાની

થાય છે.અને તેની જાણ નારોલ પોલીસસ્ટેશન માં તા – ૨૦/૦૪/૨૦૨૧

તા : ૦૬/૧૧/૨૦૨૫ પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૯

અમારા મારફતે, **એડવોકેટ વિરલ ગોદાવિચા**

સરનામુ : ૧૦૪, પ્રતિભા કોમ્પલેક્ષ,

ગાંધિગ્રામ રેલ્વેં સ્ટેશન ની સામે, સાકાર-૧ ની

આવશે. ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહીં.

ભોગવટાની આવેલ છે.

એ કરેલ છે.

સ્થળ : અમદાવાદ

ગોધરા,

સમગ્ર રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના અથાગ પ્રયત્નોથી શરૂ થયેલી "સ્વચ્છ ભારત – સ્વચ્છ ગુજરાત'' ઝુંબેશ અંતર્ગત રાજ્યુના દરેક શહેરોમાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. છતાંય, ગોધરા શહેરમાં સ્વચ્છતાની સ્થિતિ ચિંતાજનક બની

બગીચા પાસે આવેલા જાહેર શૌચાલયની બાજુમાં આવેલ મુખ્ય માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી ખાણી પીણી ના લારી ગલ્લાવાળા (યાઈનીઝ લારીઓ) સહિત આજુબાજુ ના દુકાનદારો દ્વારા ખુલ્લામાં કેચરો ઠેલવવામાં આવી રહ્યો છે. જેના કારણે શહેરની - રહ્યા છે. જેના કારેલા સહરના સુંદરતા તો બગડી જ રહી છે, પરંતુ લોકોના સ્વાસ્થ્ય પર પણ સીધી અસર પડી રહી છે. ખાસ કરીને

રાત્રિના સમયે ચાઈનીઝ લારીવાળાઓ ખુલ્લામાં ખોરાકનો બગાડ કરી અજ્ઞના ઢગલાઓ કરી દે છે, જે પછી ગાયો અને અન્ય પશુઓ તે ખાઈ લેતા હોવાથી પશુંઓના આરોગ્ય પર પણ જોખમ સર્જાઈ રહ્યું છે.આ વિસ્તારોમાં સતત ફેલાતી દુર્ગંધને કારણે રોજ સવારે વોકિંગ અને કસરત કરવા આવતા નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બગીચો વિસ્તાર જે શહેરના સૌંદર્ય અને આરોગ્યપ્રેમી નાગરિકો માટે મહત્વનો કેન્દ્રબિંદુ છે, તે જ વિસ્તાર આજે ગંદકીના ઢગલાથી દુર્ગંધિત બની ગયો છે.નગરપાલિકા તરફથી સ્વચ્છતા અભિયાન માટે કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં, મૈદાન સ્તરે યોગ્ય દેખરેખ ન હોવાને કારણે આવા દેશ્યો જોવા મળી રહ્યા

SIR 2025

આજ રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માતથાગુજરાતનામાનનીયમુખ્યમંત્રીભૂપેન્દ્રભાઇ પટેલજીનીપ્રેરકઉપસ્થિતિમ**SIR**(મતદારચાદી સુધારણા—૨૦૨૫) અંતર્ગત હિંમતનગર વિદ્યાનસભાની બેઠકનલિનકોંત ગાંધી ટાઉનહોર્લ ખાતે વર્ચ્યુઅલ વર્કશોપનું આચોજન કરવામાં આવ્યું.

આ વર્કશોપમાં પ્રદેશ ઉપાદયક્ષા કુ. કે)શલ્યા કુંવરળા પરમાર, જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના , લોકપ્રિય ધારાસભ્યશ વી .ડી . ઝાલા સાહેબ, SIR પ્રભારી ભરતભાઈ ગોંડલિયા, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, જયેશભાઈ પટેલ (APMC રોટમેન),BLA-૧ વિદ્યાનસભા વિનોદભાઈપટેલ, મંડલપ્રમુખ હિતેન્દ્રભાઈપટેલ, શહેર પ્રમુખ કુલદીપભાઈ પાઠક, ભૂમિકાબેનપટેલ, નિર્મલાબેનપટેલ તેમજ

મોટી સંખ્યામાં બુથ પ્રમુખશ્રીઓ અનેમ્ન્છ-૨ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન મતદાર યાદી સુધારણા અભિયાનના મહત્વ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું અને આવનારા સમયમાં વધુ સચોટ તથા સંપૂર્ણમતદારચાદીતૈયારકરવામાટેકાર્યકર્તાઓનેમાર્ગદર્શિતકરવામાં

ગોધરામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, ૧૬ જુગારીઓ ઝડપાચા

દરમ્યાન કુલ ૨૪ લોકો સામે ગુનો નોંધાયો ્હતો, જેમાંથી ૧૬

આરોપીઓને સ્થળ પરથી ઝડપાયા

હતા અને ૮ લોકો ફરાર થયા

હતા.ઝડપાયેલા આરોપીઓ

(૧)થાવરદાસ ડુંગરમલ કમનાની

(સિંધી) (૨) વાશુદેવ જેઠાનંદ

કૃષ્ણાણી (૩)દિલીપભાઈ તેજુમલ

સાધવાણો (૪)મુકેશભાઈ જનકલાલ ખીમનાણી (૫)રાહુલ

() સુનીલભાઈ સનાભાઈ વસાવા () જગદીશભાઈ ચતુરભાઈ

ચૌહાણ (૮)સંજયકુમાર કનુભાઈ વાણંદ (૯)નગીનકુમાર રાવતાજી ડાંગી (૧૦)ઉદયભાઈ ચંદ્રકાંતભાઈ

પટેલ (૧૧)હસમુખભાઈ બાબુભાઈ માળી (૧૨)આરીફ

ગનીભાઈ શેખ (૧૩)નીરવકુમાર

કનુભાઈ પારેખ (૧૪)તુષાર

(૧૫)મુકેશકુમાર ઈશ્વરલાલ મુલચંદાણી (૧૬)ભાવેશકુમાર

રજનીકાંત સુથારઆ તમામ આરોપીઓ ગોધરા, આણંદ, વડોદરા અને ખેડા જિલ્લાના

કરમચંદાણી

ટેલીયાણી

સાધવાણી

નરેશભાઈ

પ્રકાશકુમાર

(પ્રતિનિધિ)ગોધરા, કુલ રૂ. ૨,૬૫,૨૦૦ નો મુદ્દામાલ શહેરમાં જુગારના ધંધા કબજે કર્યો હતો.આ કાર્યવાહી

ગોધરા શહેરમાં જુર્ગારના ધુંધા પર ગાઠ પાડવા સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગર દ્વારા ગુરુવારની મોડી રાતે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરોડામાં પોલીસે મીનાક્ષી બંગ્લોઝ પાછળ, ડોળપા તળાવ નજીક આવેલા એક જુગારધામ પર છાપો મારી ૧૬ જુંગારીઓને ઝડપી પાડ્યા, જ્યારે ૮ આરોપીઓ સ્થળ પરેથી ફરાર થવામાં સફળ રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ ભરતદાન વજેસંગ ટાપરિયાના નેતૃત્વ હેઠળની ટીમે આ ઓપરેશન સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો. ટીમને ગુપ્ત માહિતી મળી હતી કે, ડોળપા તળાવ નજીક એક ખાનગી જગ્યાએ જુગારીઓ રાત્રિના સમયે "અંદર-બહાર'' અને "તીન પત્તી" જેવી જુગાર ની ગેમ રમતા હોય છે. તે આધારે પોલીસે યોજના બનાવી દરોડો પાડ્યો હતો.સ્થળ પરથી પોલીસે રૂ. ૮૧,૭૦૦ રોકડા, ૧૫ મોબાઇલ કોન (કિંમત રૂ. દ૫,૦૦૦) અને દ ટુ-વ્હીલર (કિંમત રૂ. ૧,૨૦,૦૦૦) સહિત

નામ બદલેલ છે

મેં મારું નામ **વડોર રસીલાબેન** ભીમજી હતું, જે બદલીને રસીલા **ભીમજી વડોર** કરેલ છે. સરનામું : ૧૦૦૩- ૧૦મો માળ, શિખર ટાવર, વિકાસગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭

નામ બદલેલ છે

મેં મારું નામ મારફતીયા મોહમોદમોઈઝ મોહમોદનઝીર હતું, જે બદલીને મોહંમદમોઈઝ મોહંમદનજીર મારફતીયા કરેલ છે. સરનામું : વ્હોરવાડ પ્રાંતિજ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા-૩૮૩૨૦૫ 3259

નામ બદલેલ છે

મેં મારું નામ **વડોર ભીમજી** જેઠાલાલ હતું, જે બદલીને **ભીમજી વડોર** કરેલ છે. ક્ષરનામું : ૧૦૦૩- ૧૦મો માળ, શિખર ટાવર, વિકાસગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭

રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

લેસ્ટર્ન ટાઇસ્સ વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.

-જાહેરખબર મેનેજર

સાર્ધ શતાબ્દી વર્ષ નિમિત્તે વંદે માતરમુના જયઘોષ થકી ગરિમામય ભારત ભૂમિને કોટી કોટી વંદન...

દેશભક્તિના અભૂતપૂર્વ સમયમાં જીવી રહ્યા છીએ. આઝાદી પહેલાં જે દેશભક્તિનો માહોલ હતો એવો દેશભક્તિનો માહોલ આપણા દેશભક્ત વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ દ્વારા શરૂ કરાયેલ 'આત્મનિર્ભર ભારત'અને 'રાષ્ટ્ર પ્રથમ' જેવા નૂતન અભિયાનની પ્રેરણાથી સર્જાઇ રહ્યો છે. આજે વધુ એક દેશભક્તિનું સ્મરણપર્વ ઉજવવાની ઘડી છે. ઇ.સ. ૧૮૭૫માં લખાયેલું આપણું વંદે માતરમ્ ગીત ૧૫૦ વર્ષ પૂરા કરી રહ્યું છે. આ ગીત બંકિમચંદ્ર ચર્ટ્ટોપાધ્યાયજી દ્વારા આનંદમઠ નવલકથામાં પહેલીવાર પ્રકાશિત થયું હતું, પણ આ ગીતે દેશની ચેતનાને જગાવી એના આ સુદીર્ઘ ચતનાન જગાવા અના આ સુદાવ ગાયનકાળમાં જાણે કે રાષ્ટ્રભક્તિના પ્રાણવાયુ જેવી ઊર્જા ઉત્પન્ન કરી. આ ગીતમાં રહેલી ઉદ્દાત્ત દેશભક્તિ અને ઊર્જા સમગ્ર

સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોમવંતી બની રહી. ઇતિહાસકારોનું માનવું છે કે, સ્વાતંત્ર્ય સંગ્રામ હોય કે સ્વદેશી ચળવળ હોય, કે પછી સત્યાગ્રહની તૈયારીઓ હોય, વંદે માતરમ્ ગવાય એટલે દેશભક્તિનું ઊર્જાવાન વાતાવરણ સ્થાઈ જતું. આઝાદીની ચળવળ દરમિયાન પણ અનેક નેતાઓ આ ગીતની એક એક પંક્તિને ચરિતાર્થ કરવા માટે પોતાનું જીવન ખપાવી રહ્યા હતા. મહર્ષિ અરવિંદ હોય કે ભગતસિંહ, સૌ દેશભક્તો આ ગીતના ગુંજનમાં પોતાના જીવનની સાર્થકતા જોતા

આ રાષ્ટ્રીય ગીતની મહાનતા એ છે કે, એ આજે પણ એટલું જ પ્રસ્તુત અને તાજગીભર્યું છે. આધુનિક યુગના લોકનાયક આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે કોઈ સભાને સંબોધવાના હોય ત્યારે શરૂઆતમાં વંદે માતરમ્ નો જયઘોષ કરાવે , ત્યારે જાણે કે સમગ્ર સભામાં દેશભક્તિનું એક મોજું ફરી વળે છે.

આ ગીત ભારતીયતાની ભાવનાને રજૂ કરે છે, આ દેશની સુજલામ્ સુફલામ્ ધરતી અને ભારત માતા પ્રત્યેની ભક્તિ દરેક શબ્દમાંથી નીતરે છે. જ્યારે વંદે માતરમ્ ગીત સાંભળીએ ત્યારે માતૃભક્તિનો અને ભારત માતાની આરાધના કરતા હોઈએ એવો ભાવ ઊભો થાય છે. આ ગીતનાં શૌર્ય અને પરાક્રમથી રોમ રોમ જાગી ઊઠે

આપણું સદ્ નસીબ છે કે દેશનું સુકાન જયારથી નરેન્દ્રભાઈ મોદીએ સેંભાળ્યું છે, ત્યારથી જાણે કે આ વંદે માતરમ્ ગીતના શબ્દો પુનઃ જાગૃત થઈ ગયા છે. સૌ કોઈને લાગે છે કે આ ગીતમાં રહેલી દેશભક્તિને આદરણીય નરેન્દ્રભાઈએ જાણે મૂર્તિમંત કરી છે, એક ગીતના શબ્દોને રાષ્ટ્રના જીવનમાં કેવી રીતે ઉતારી શકાય એ માટેની પ્રેરણા અને પરિશ્રમ આજે પરિણામો આપી

રહ્યા છે. આઝાદીની લડાઈમાં એ વખતે 'આનંદમઠ' નવલકથામાં સંન્યાસીઓના સંઘર્ષની વાત આવતી હતી, આજે નરેન્દ્રભાઈની તપશ્ચર્યા અને ત્યાગ આ ગીતના શબ્દોને જાણે ચરિતાર્થ કરી રહ્યા છે. એ દિવસ યાદ કરો, જ્યારે કાશ્મીરના લાલ ચોકથી નરેન્દ્રભાઈએ 'ત્વં હિ દુર્ગા..'નો

માં ભારતીને ખરા હૃદયથી વંદન એટલે 'વંદે માતરમ'. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા રચિત આ ગીત સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમના ઉદ્ ઘોષ સમું બન્યું હતું. આ ગીતનો પ્રત્યેક શબ્દ અને પ્રત્યેક શબ્દમાંથી વ્યક્ત થતા પ્રત્યેક તેજબિંદુએ સ્વાતંત્ર્ય સેનાનીઓમાં બ્રિટીશ સામ્રાજ્યને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ઉદ્દીપકનું કાર્ય કર્યું હતું. ઈ.સ. ૧૮૭૫માં લખાયેલા આ ગીતને આ વર્ષે ૧૫૦ વર્ષ પૂરા થઈ રહ્યાં છે, ત્યારે એક વાત ચોક્કસ છે કે, આ માત્ર એક ગીત નથી, માત્ર શબ્દોથી રચિત કોઈ ગાન નથી, પરંતુ 'વંદે માતરમ' સાચા અર્થમાં ભારત માતાને વંદન છે, નમન છે. વંદે માતરમ્ ગીતની સાર્ધ શતાબ્દી વેદ માતરમું ગાતમાં સાપ રાતાબ્દા નિમિત્તે ૭ કરોડ ગુજરાતીઓ વતી હું પણ આ ગીતને વંદન કરી મા ભારતી માટેની કૃતજ્ઞતા અને અહોભાવ વ્યક્ત કરું છું. વંદે માતરમું ના ૧૫૦માં વર્ષને એક વિશેષ વર્ષ તરીકે ઉજવવાનું 'વિઝન' આપનાર ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વમાં આ ગીત અસ્ખલિત રીતે વ્યક્ત થાય છે. મોદીજી દ્વારા આપવામાં આવેલ વંદે માતરમ્ ગીતના ૧૫૦મા વર્ષની ઉજવણીના કાર્યક્રમ થકી મા ભારતીના સંતાનોનું કલ્યાણ થાય, તેઓ ગર્વથી માથું ઊંચું

ભાવ સમગ્ર દેશમાં જગાવેલો.

ભાવના નિહિત છે. આઝાદ ભારતના ઈતિહાસમાં આપણને એવું નેતૃત્વ ભાગ્યે જ જોવા મળશે કે, જેમણે પોતાના પ્રત્યેક કાર્ય અને શ્વાસને રાષ્ટ્ર માટે સમર્પિત કર્યા હોય અને એ કહેતાં મને ગર્વની લાગણી અનુભવાય છે કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમાં પ્રથમ હરોળમાં સ્થાન ધરાવે છે. મોદીજીના દરેક કાર્યમાં 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવના અગ્રીમ રહી છે.

કરી ગૌરવભેર જીવન જીવી શકે તેં

વર્મા'ને સાચા અર્થમાં સ્મરણાંજલિ આપવા માટે માંડવી ખાતે ક્રાંતિતીર્થની સ્થાપના હોય કે, પછી બલિદાનના પર્યાય એવા 'ભૂચર મોરી'ના મહત્વને ઉજાગર કરવાનું હોય, સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસીઓના બલિદાનના ઉદાહરણરૂપ એવા "ભગવાન બિરસા મુંડા"ના

મહત્વને દુનિયા સમક્ષ લાવવાની વાત હોય કે, પછી રાષ્ટ્રીય એકતાના પર્યાય એવા સરદાર વલ્લભભાઈ પટેલને 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' અને 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે સ્મરણાંજલિ આપવાની વાત હોય, મોદીજીના દરેક કાર્યમાં આપણને માત્ર એક જ ભાવ અનુભવાય છે અને તે છે 'વંદે માતરમ' આ વંદે માતરમ ગીતનો જાણે કે યથાર્થ મહિમા કરતા હોય એમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ

રાજનીતિને એક નવો વળાંક આપ્યો, વિકાસનો નવમાર્ગ ચીધ્યો. મોદીજી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પંચશક્તિની વાત કરી, જળ વ્યવસ્થાપનની વાત કરી કારણ કે વંદે માતરમ્માંથી એમને પ્રેરણા મળી હતી કે આ ધરતી સશ્યશ્યામલા ઉર્વરક ભૂમિ છે. એમણે વડાપ્રધાન બનીને પણ કન્યા કેળવણી અને સમગ્ર શિક્ષાને એક નવી દિશા મળે એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડી, કારણ કે મોદી સાહેબ આખી જિંદગી ગાતા રહ્યા, 'વાણી

ભૂપેન્દ્રભાઈ પટેલ

વિદ્યાદાયિની, નમામિ ત્વામ્, અમલામ્ અતુલામ્પ આ શબ્દોમાં રહેલી અપાર શક્તિથી કન્યા કેળવણીની શરૂ થયેલી યાત્રા ચંદ્ર ઉપર શિવશક્તિના પોઇન્ટની પ્રસ્તાવના સુધી પ્રસરેલી છે. આપણે જોઈ શકીએ કે, રાત-દિવસ દેશ માટે મહેનત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આ વંદે માતરમ્ના ગીતને જાણે કે જીવી રહ્યા છે, 'ત્વં હિ પ્રાણા શરીરેપ' એમ એમ કહેતા કહેતા જાણે કે પ્રત્યેક શ્વાસ રાષ્ટ્ર માટે સમર્પિત કરવાની ભાવનાનું એક ઉત્તમ આદર્શ જીવન જીવીને સૌ કોઈ દેશવાસીઓને પ્રેરણા આપી રહ્યા છે. જ્યારે શૌર્ય બતાવવાનું આવ્યું, તો કાયર દુશ્મનોને 'ઑપરેશન સિંદૂર' દ્વારા દર્શાવી હીધું કે, આ રાષ્ટ્ર અમારી માતા છે અને અમે અને વર્ષોથી 'બ હુ બ લ ધ ા રિ ણી મ રિપુદલવારિણીમ' એમ કહીને સંબોધી છે. આ દેશભક્તિ એ જ આ ગીતની પ્રાણ શક્તિ છે અને એને આપણને જાણે કે દસે દિશાઓમાંથી ઊર્જા આપી છે.. આજે જે માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ વિક્રાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત થઈ રહી છે, તેમાં સૌ કોઈને એવી આતુરતા છે, એવી ખેવના છે કે આપણી ભારત માતા સુખદા અને વરદા બને. એટલા માટે ભારતને વિકસિત બનાવવા માટે જાણે કે એક દીર્ઘદેષ્ટા વડાપ્રધાન આપણને મળ્યા છે. આ ગીતના શબ્દોને વ્યક્ત સ્વરૂપ આપીને તેઓ એક નવા

યુગનું સર્જન કરી રહ્યા છે. જગતજનની અને આપણી ભારત માતા આપણને એવી શક્તિ બક્ષે જેનાથી ૨૦૪૭માં જ્યારે ભારતની આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થાય, ત્યારે નરેન્દ્રભાઈ આપણુને બોલાવે છે એ જ ખુમારીથી અને ગૌરવથી આપણે વિશ્વ સમક્ષ જય ઘોષ કરી શકીએ, અને ગાઈ શકીએ, 'વંદે માતરમ્પ - લેખક ગુજરાતના મુખ્યમંત્રી

ગેલન્ટ સ્પોર્ટ્સ ૨૩ પ્રીમિયર ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સાથે ગુજરાતના સ્પોર્ટ્સ ક્ષેત્રને વિસ્તૃત કરે છે

અમદાવાદ,

સ્પોર્ટ્સ માટે તૈયાર ભારતનું નિર્માણ કરવાની દિશામાં ગેલન્ટ સ્પોર્ટ્સએ વધુ એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ ગુજરાતમાં ૨ ૩ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ પ્રોજેક્ટ્સમાં ઓંતરરાષ્ટ્રીય ધો૨ેેેેશના આર્ટિફિશિયલ ટર્ફ (Artificial Turf),

પ્રીમિયમ પીવીસી વિનાઇલ સ્પોર્ટ્સ ફલોરિંગ, પીપી ઇન્ટરલોકિંગ ટોઇલ્સ, જીમ-ગ્રેડ રબર ફ્લોરિંગ (rubber floroing) અને વ્યવસાયિક ટેબલ ટેનિસ સેટઅપનો સમાવેશ થાય છે, જે શાળાઓ, સ્પોર્ટ્સ એકેડમીઓ,

રહેણાંક સંકુલ અને હોસ્પિટાલિટી ડેસ્ટિનેશન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

વર્ષોથી, બિન-મેટ્રો શહેરોમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુલભતા અને ગુણવત્તામાં મૈર્યાદાઓ હતી, જેણે ગ્રાસરૂટ્સ ડેવલપમેન્ટને અવરોધિત કર્યું હતું. ગુજરાત, જે શિક્ષણ અને કર્યું હતું. યુક્સા, ક સાંચકા હતા સામુદાયિક જીવન પ્રત્યેના તેના પ્રગતિશીલ અભિગમમાટે જાણીતું છે, તે હવે શાળાઓ, ક્લબો અને જીવનશૈલીની જગ્યાઓમાં વૈશ્વિક-ધોરણની રમતગમત સુવિધાઓને એકીકૃત કરીને નવા માપદંડો સ્થાપિત

(રૂ. કરોડમાં)

રજિ.ઓફિસઃ ૩-૧૧, જી.આઈ.ડી.સી., વાપી, વલસાડ-૩૯૬ ૧૯૫, ગુજરાત.

ટેલીફોન નં.+૯૧ ૨૬૦ ૨૪૩૨૭૧૬, ઈમેલઃ upl.investors@upl-ltd.com વેબસાઈટઃ www.upl-ltd.com



૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ પુરા થતા ત્રીમાસીક અને અર્ધવાર્ષિક અંતના કોન્સોલીડેટેડ અનઓડિટેડ નાણાંક્ચિ પરિણામોનો અહેવાલ

			ત્રિમાસીક અં	તે	અર્ધ વાર્ષિક અંતે		વર્ષના અંતે
ક્રમ નં.	વિગતો	સપ્ટે-૨૫	જુન-૨૫	સપ્ટે-૨૪	સપ્ટે-૨૫	સપ્ટે-૨૪	માર્ચ-૨૫
٦٠.		(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(ઓડિટેડ)
٩.	કામગીરીમાંથી કુલ આવક	૧૨,૦૧૯	૯,૨૧૬	11,060	૨૧,૨૩૫	૨૦,૧૫૭	४६,६३७
₹.	કર પહેલાંના સમયગાળા માટે ચોખ્ખો નફો / (નુકસાન)	६४२	(१८१)	(४३૯)	४६१	(૮૪૫)	૧,૨૩૭
	અસાધારણ વસ્તુઓ પહેલાં						
з.	કર પહેલાંના સમયગાળા માટે ચોખ્ખો નફો / (નુકસાન)	9८४	(૧૯૦)	(४४७)	૫૯૪	(૯૦૨)	८२५
8.	કર પછીના સમયગાળા માટે ચોખ્ખો નફો / (નુકસાન)	૬૧ ૨	(૧૭૬)	(૫૮૫)	४उ६	(૧,૧૧૨)	८२०
ս.	કુલ વ્યાપક આવક તે સમયગાળા માટે	૧,૦૧૬	४३४	₹00	૧,૪૫૦	૧૬૨	४२
ξ.	કંપનીના શેરધારકોને આ સમયગાળા માટે અન્ય વ્યાપક આવક/(નુકસાન)	૧,૬૨૮	રપ૮	૧૫	१,८८६	(૯૫૦)	८६२
၂၅.	અવધિ માટે કંપનીના માલિકોને લગતું કુલ વ્યાપક આવક / (નુકસાન)	૧,૩૦૬	૧૯૫	પક	૧,૫૦૧	(६७७)	८६०
۷.	પેઇડ અપ ઇક્વિટી શેર કેપિટલ	૧૬૯	૧૫૯	૧૫૦	१६७	૧૫૦	૧૫૯
	(શેરનું ફેસ વેલ્યુ - રૂ. ૨/- દરેક)						
હ.	અન્ય ઇક્વિટી	-	-	-	-	-	૨૯,૦૫૪
૧૦.							
	બેઝિક રૂ.	€.૭૫	(૧.૯૪)	(૫.૬૮)	૪.૮૫	(૧૧.૪૭)	૯.૮૫
	ડાયલ્યુટેડ રૂ.	€. ૭૫	(૧.૯૪)	(૫.૬૮)	૪.૮૫	(૧૧.୪૭)	૯.૮૫

૧. ઉપરોક્ત ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને અર્ધ વાર્ષિક અંત માટેના સિક્યુરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયાના નિયમન ૩૩ હેઠળ સ્ટોક એક્સ્ચેંજમાં ફાઇલ કરેલા અનઓડીટેડ કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામોના વિગતવાર બંધારણનો એક અર્ક છે (લિસ્ટીંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટસ) નિયમો, ૨૦૧૫ સુધારેલા (SEBI LODR નિયમો) મુજબ. ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને અર્ધ વાર્ષિક અંતના અનઓડીટેડ નાણાકીય પરિણામો (સ્ટેન્ડલોન અને કોન્સોલિડેટેડ)નું સંપૂર્ણ બંધારણ કંપનીની વેબસાઇટ www.upl-ltd.com અને BSE (www.bseindia.com) અને NSE (www.nseindia.com)

૨. મુખ્ય સ્ટેન્ડલોન નાણાંકીય માહિતી નીચે મુજબ છેઃ

અર્ધ વાર્ષિક અંતે વર્ષના અંતે માર્ચ-૨૫ સપ્ટે-૨૪ (ઓડિટેડ) 9,८૯૨ ૫,૩૩૦ ૩૨ ૨,૦૪૫ २,६४३ ૨૯

(રૂ.કરોડમાં)

ક્રમ વિગતો સપ્ટે-૨૫ સપ્ટે-૨૪ સપ્ટે-૨૫ જુન-૨૫ નં. (अनओडिटेड) (અનઓડિટેડ) (અનઓડિટેડ) (અનઓડિટેડ) (અનઓડિટેડ) ચાલુ કામગીરીમાંથી કુલ આવક ૧,૫૧૨ 3,992 ચાલુ કામગીરીથી કર પહેલાં નફો / (નુકસાન) ૩૫૫ ૧૩૨ ४८ ४८७ ચાલું કામગીરીથી કર પછી નફો / (નુકસાન) 3 ૨૭૨ ૧૨૨ ૪૫ 368 બંધ કામગીરીથી કર પહેલાંનો નફો / (નુકસાન) ૧૫૨ ૨૫૦ 336 કામગીરી બંધ કરવાથી કર પછીનો નફો / (નુકસાન) 902

ત્રિમાસીક અંતે

૩. ઉપરોક્ત પરિણામોની સમીક્ષા પમી નવેમ્બર ૨૦૨૫ના રોજ થયેલી ઓડિટ કમિટી દ્વારા બોર્ડ ઓફ ડાયરેક્ટરને ભલામણ કરવામાં આવી છે અને ત્યારબાદ ૬ઠી નવેમ્બર ૨૦૨૫ના રોજ મળેલી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ પરીણામો સ્ટેચ્યુટરી ઓડીટર દ્વારા મર્યાદિત સમીક્ષાને આધિન કરવામાં આવ્યા છે.

યુપીએલ લિમિટેડ વતી,

રાજ તિવારી (DIN:09772257) હોલટાઈમ-ડાચરેક્ટર

NALIN LEASE FINANCE LIMITED

CIN: L65910GJ1990PLC014516 Regd.Off: Ground Floor, Gandhi Nursing Home Bldg., Dr.Nalinkant Gandhi Road, Himatnagar- 383 001. Gujarat India Phone: 02772-241264, 242264, email: info@nalinfin.co.in, www.nalinfin.co.in

EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL DESILITS FOR THE QUARTER ENDER ON 30 00 2025

ı	RESULTS FOR THE QUARTER ENDED ON 30.09.2025							
	SI. No.	PARTICULARS	ı	For the year ended				
ı			30 Sep 2025	30 June 2025	30 Sep2024	31 March 2025		
ı			Unaudited	Unaudited	Unaudited	Audited		
ı	1.	Total Income From Operations	177.67	204.76	173.65	642.28		
	2.	Net Profit/(loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	107.41	135.37	116.13	442.69		
	3.	Net Profit/(loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	107.41	135.37	116.13	442.69		
	4.	Net Profit/(loss) for the period after Tax(after Exceptional and/or Extra- ordinary items)	76.13	92.40	69.39	352.34		
	5.	Total Comprehensive Income for the period (Comprising Profit /(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax)	76.13	92.40	69.39	352.34		
ı	6.	Paid up Equity Share Capital	655.82	655.82	655.82	655.82		
	8.	Earnings Per share (of Rs 10/- each) (for continuing and discontinuing operations)-						
ı	1.	Basic:	1.16	1.41	1.06	5.37		
ı	2.	Diluted:	1.16	1.41	1.06	5.37		

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Ex changes under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015 The full format of the Quarterly Financial Results is available on the BSE website (www.bseindia.com) 8 Company's website (www.nalinfin.co.in)

Place: Himmatnagar

Date : 06-11-2025



For, NALIN LEASE FINANCE LTD Harsh D Gandhi Managing Director

સ્થળ : મુંબઈ તારીખ : ક નવેમ્બર, ૨૦૨૫